

ઓનલાઇન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને કોઈપણ મુશ્કેલી કે સમસ્યા હોય તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો સંપર્ક કરવા અનુરોધ...

કેન્દ્ર સરકાર દ્વારા નિકાસકારો માટે સર્ટિફિકેટ ઓફ ઓરીજન ઈશ્યુ કરવા માટે નવેમ્બર-૨૦૨૧ થી કોમન ડિઝિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઓનલાઇન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને ભોગવવી પડતી વિવિધ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી DGFT દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી મુદત વધારવામાં આવેલ હતી. આ દરમ્યાન નિકાસકારોને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી રજુઆત કરી મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ લાવેલ છે અને હજુ પણ જ્યાં સુધી કોમન ડિઝિટલ પોર્ટલમાં મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી મેન્યુઅલી ચાલું રાખવા રજુઆત કરેલ છે.

હાલ ૧લી એપ્રિલ ૨૦૨૨ થી ફરજિયાત ઓનલાઇન સર્ટિફિકેટ ઓફ ઓરીજન ઈશ્યુ કરવાનું રહેશે. જે અંતર્ગત નિકાસકારોને પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવામાં કે એપ્લીકેશન સબમીટ કરવામાં કોઈપણ મુશ્કેલી કે સમસ્યા ઉદ્ભવતી હોય રાજકોટ ચેમ્બરના ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૪૦૦ / ૨૨૨૭૫૦૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. જેથી નિકાસકારોને પડતી મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરી શકાય. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-રાજકોટ દ્વારા AI Based Automated Grain Analyzer & Automatic Moisture Meter અંગે સેમિનાર યોજવામાં આવેલ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-રાજકોટ દ્વારા AI Based Automated Grain Analyzer & Automatic Moisture Meter અંગે તા.૧૨-૪-૨૦૨૨ ના રોજ સેમિનાર યોજવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા તથા કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીના ચીફ જનરલ મેનેજરશ્રી એએસ અરૂણાચલમ, ગુજરાતના જનરલ મેનેજરશ્રી શ્રીકાંત પ્રસાદ, અમદાવાદના આસી.જનરલ મેનેજરશ્રી શિવકુમાર ચંદન તથા રાજકોટના ડી.એમ.શ્રીમતી રાખી નિહલાની ઉપસ્થિત રહેલ.

સેમિનારના પ્રારંભે FCI અમદાવાદના આસી.જનરલ મેનેજરશ્રી શિવકુમાર ચંદન દ્વારા સૌને આવકારી આજના આ સેમિનારનું આયોજન કરવા બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યક્ત કરેલ. તેમજ કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે માહિતગાર કરેલ. ત્યારબાદ FCI ગુજરાતના જનરલ મેનેજરશ્રી શ્રીકાંત પ્રસાદએ ખાદ્ય નિગમ દ્વારા કોરોના કપરાકાળ દરમ્યાન લોકડાઉનમાં પરિવારોને અનાજ વિતરણ કરીને ઘણો સિંહ ફાળો આપ્યો છે. તેમજ આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ બેઈઝ ઓટોમેટેડ મશીન અંગે ટુંકી માહિતી આપેલ. તેમજ આવા મશીન રાજકોટમાંથી ઉપલબ્ધ થવાથી ઔદ્યોગિક એકમોને વેગ મળશે તથા નિકાસમાં પણ વૃદ્ધિ થશે.

ત્યાર બાદ FCI ન્યુ દિલ્હીના ચીફ જનરલ મેનેજરશ્રી એએસ અરૂણાચલમ દ્વારા આજના આ સેમિનાર માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ માહિતી આપેલ. જેમાં ખાસ કરીને Quality Specifications, Uniform specifications of Paddy / Rice / Wheat KMS 2021-22, Pictorial depiction of refractions of Raw rice, Generic Specification of Automation Grain Analyzer, Generic Specification of Moisture Meter, Requirement of Automatic AI based grain analyser and moisture meter, Purchasing of equipments through GeM Portal, વિગેરે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરેલ.

ત્યાર બાદ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે. તેને બિરદાવી સમગ્ર દેશમાંથી માત્ર ચાર શહેરોમાંથી રાજકોટ ખાતે જ આવા મશીન બનાવવા માટેનો આગ્રહ દર્શાવેલ છે. જે સરાહનીય છે. ત્યારે રાજકોટના સમગ્ર ઔદ્યોગિક એકમો આવા મશીન બનાવવા ઉત્સાહ દાખવશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમજ રાજકોટથી ૧ લાખથી પણ વધુ આવા ઓટોમેટેડ મશીન બનાવવા સાથે અને સહકાર આપવામાં આવશે તેવી આત્રી આપેલ.

સેમિનારના અંતે ઉપસ્થિત સભ્યશ્રીઓ તથા મહાનુભાવોનો આભાર વ્યક્ત તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન FCI રાજકોટના મેનેજરશ્રી એમ.જી પાટીલ દ્વારા કરવામાં આવેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.